

જાન્યુઆરી 29, 2019

બ્રામ્પટન શિયાળુ તોફાન અઘતન માહિતી: તમારે શું જાણવાની જરૂર છે

બ્રામ્પટનને રેકોર્ડ-નોડનારી બરફવર્ષા લાવનાર પ્રચંડ શિયાળુ તોફાનથી સખત ફટકો પડ્યો છે. અહીં તમારે આજે, જાન્યુઆરી 29 નાં રોજ જાણવા લાયક માહિતી છે:

સેવા સ્તરો

બરફ પડવાનું સવારે લગભગ 4:30 વાગ્યે બંધ થયું, અને કર્મચારીઓ રસ્તાઓ, સાઈડવોક્સ (ફૂટપાથ), ટ્રેઈલ્સ (પગદંડીઓ), ટ્રાન્ઝિટ સ્ટોપ્સ, સ્કૂલ કોસિંગ્સ, અને ફાયર હોલ અને રિક્રિએશન સેન્ટર પાર્કિંગ લોટ્સની મોટા પાયે સફાઈ કામના વચગાળે પહોંચ્યા છે.

કર્મચારીઓ શહેરના દરેક વિસ્તારમાં પહોંચવા મહેનતભરી કામગીરી કરી રહ્યા છે, પરંતુ કામમાં થોડોક સમય લાગશે. આ તોફાનની ગંભીરતાને લીધે, એક નોંધપાત્ર હવામાન પ્રસંગની ઘોષણા કરવામાં આવી હતી. બરફવર્ષા અંતિમ તબક્કામાં પહોંચે પછી (ગુરુવાર, જાન્યુઆરી 31 નાં રોજ સવારે 4:30 વાગ્યા સુધીમાં) બધી બરફ સફાઈ કામગીરીઓ 48 કલાકમાં પૂરી થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

કેટલાક રસ્તાઓ અને સાઈડવોક્સ પરથી બરફ સાફ કરવામાં ન આવે ત્યાં સુધી તેની પર પ્રવાસ કરવાનું મુશ્કેલભર્યું બની રહેશે. કૃપા કરી ધીમા પડશો અને તમને પોતાને વધારે સમય આપશો.

અમે આ સફાઈકામ દરમિયાન આપણાં રહેવાસીઓના સહયોગ અને ધીરજની કદર કરીએ છીએ. એક વખત સફાઈકામ પૂરું થાય એટલે, રહેવાસીઓ 311 નંબર પર ફોન કોલ કે 311@brampton.ca સરનામે ઈમેલ કરી શકે છે જો તેઓને લાગે કે તેઓની સ્ટ્રીટ ચૂકી જવાઈ હોય.

સ્મૃતિપત્રો:

- મુખ્ય રસ્તાઓની જેમ લાદી દેખીતી કરવા રહેવાસી સ્ટ્રીટ્સ પરથી બરફ હટાવવામાં આવતો નથી. તમારી સ્ટ્રીટ પરથી બરફ હટાવ્યા પછી કંઈક બરફ સ્ટ્રીટ પર રહે તે સામાન્ય બાબત છે.
- કર્મચારીઓ રસ્તાઓ સાફ કરે એટલે, બરફ રહેવાસીઓના ડ્રાઈવવેના અંતે છોડવામાં આવશે. અમે સમજીએ છીએ કે આ રહેવાસીઓ માટે નિરાશાજનક બાબત બની શકે છે, પરંતુ દુર્ભાગ્યવશ આ બરફના ઢગલાઓ ('વિન્ડરોસ') ટાળી શકાતા નથી.
- કૃપા કરી પાર્ક કરેલી બધી કારોને સ્ટ્રીટ પરથી ખસેડી લો જેથી કરીને કર્મચારીઓ સુરક્ષિતપણે તે સાફ કરી શકે છે.
- કૃપા કરી સાઈડવોક્સ પરથી હિમ અને બરફ કાઢી નાખીને તેઓને સુરક્ષિત રાખવામાં મદદ કરો. વડીલો અને કાયમી અશક્તતાઓ સાથે જીવતા રહેવાસીઓ માટે, આ શહેરે બરફ કાઢવા નાણાકીય સહાયતા આપવાની તૈયારી બતાવી છે. વધુ માહિતી અહીં જાણો,

www.brampton.ca/snow

ટ્રાન્ઝિટ (પરિવહન)

બ્રામ્પટન ટ્રાન્ઝિટ કેટલાક માર્ગો પર વિલંબનો અનુભવ કરી રહ્યું છે. કૃપા કરી તમે પોતાના માટે પુષ્કળ વધારાનો પ્રવાસ સમય રાખશો. અઘતન માહિતી માટે, Twitter પર [@BramptonTransit](https://twitter.com/BramptonTransit) ને અનુસરો અથવા 905.874.2999 નંબર પર ફોન કોલ કરો. સાવધ રહો અને બસ સ્ટોપ્સ અને ટર્મિનલ્સ પર તમારા પગલા જોઈને મૂકો.

મનોરંજન કેન્દ્રો (રિક્લિએશન સેન્ટર્સ)

રિક્લિએશન સેન્ટર્સ ખુલ્લા છે, પરંતુ મોટા ભાગના નોંધાયેલા અને ડ્રોપ-ઇન કાર્યક્રમો આજ રોજ સવારે રદ થયા છે. નિયમિત કાર્યક્રમો આજે બપોર સુધીમાં પુનઃચાલુ થાય તેવી અપેક્ષા છે. રહેવાસીઓને અગાઉથી પોતાના રિક્લિએશન સેન્ટરને ફોન કોલ કરવાનું કહેવામાં આવે છે.

બ્રામ્પટન લાઈબ્રેરી

બ્રામ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ આજ રોજ સવારે બંધ છે અને ફરી બપોરે 1 વાગ્યે ખુલશે.

સંપર્કમાં રહો:

- બરફ સાફ કરવાને લગતી અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/snow જોતા રહો
- સીટી ઓફ બ્રામ્પટનને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર અનુસરો
- શિયાળુ સુરક્ષા સંબંધિત ખાનગી માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/prepared
- વિનંતીઓ ઈમેલથી 311@brampton.ca ને મોકલો અથવા શિયાળુ કામગીરીઓના સંબંધમાં તાકીદની પરિસ્થિતિઓમાં 311 નંબર પર ફોન કોલ કરો

-30-

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રામ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca